

LL.B. Semester - 1 (CBCS) Examination
Feb/Mar. -2021 (NEW COURSE)
BANKING LAW (CORE/ELECTIVE)

Time: 1:30 Hours

Marks: 42

Instructions:

1. Figures to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

-
- પ્રશ્ન.૧ ભારતમાં બેંકિંગ સંસ્થાઓનો વિકાસ સમજાવો. (૧૪)
- પ્રશ્ન.૨ રીઝર્વ બેંકની સત્તા અને કાર્યો જણાવો. (૧૪)
- પ્રશ્ન.૩ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટનું મહત્વ અને લક્ષણો જણાવો. (૧૪)
- પ્રશ્ન.૪ ચેકની ચૂકવણી કરનારની જવાબદારી વર્ણવો. (૧૪)
- પ્રશ્ન.૫ સમજાવો. (ગમે તે બે) (૧૪)

1. રિઝર્વ બેંકની શાખા નિયંત્રણ નિતિ
2. આંતરદેશી અને વિદેશી ઇન્સ્ટ્રુમેન્ટ
3. બેંકિંગ લોકપાલ
4. પરાક્રમ્યતા

ENGLISH VERSION

- Q.1 Explain the development of Banking Institutions in India. (14)
- Q.2 Explain the powers and functions of the Reserve Bank of India. (14)
- Q.3 Give the importance of Negotiable instrument Act and characteristics of Negotiable under the Negotiable Act. (14)
- Q.4 Describe the Liabilities of drawer of the cheque. (14)
- Q.5 Explain. (any two) (14)
1. Credit control policy of R.B.I.
 2. Indian and foreign Instrument
 3. Banking ombudsman
 4. Negotiability
